



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
છબ્બે માળ, ગિફ્ટ વન, માર્ગ-૫-સી, ઝોન-૫,
ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨ ૩૫૫, ગુજરાત.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ સમક્ષ,
ગાંધીનગર

નીચેની બાબતો અંગે,

આયોગ દ્વારા જાહેર કરાયેલ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(રિન્યુબલ સંસાધનોમાંથી વીજળીની પ્રાપ્તિ)ના વિનિયમો ૨૦૧૦ તથા સમયાંતરે કરાયેલ સુધારાના અનુસંધાને ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા રાજ્યના વિતરણ પરવાનેદારો ના વર્ષ ૨૦૧૭-૧૮ ના RPO ના અમલીકરણની ચકાસણી માટે સ્વયં અરજી નં ૧૮૭૨/૨૦૨૦ શરૂ કરાઈ છે.

જાહેર નોટિસ

ટોરેન્ટ પાવર લિમિટેડ અને એમપીએસઇએડ યુટિલિટીઝ પ્રા. લિમિટેડે RPO ના પાલન માટે ૨૦૧૭-૧૮ નાણાકીય વર્ષની તેની ટકાવારીની માટે દાખલ કરેલ અનુક્રમે અરજી નં. ૧૭૫૪/૨૦૧૮ અને ૧૭૮૫/૨૦૧૯ આયોગને મળી છે. ઉક્ત અરજીમાં, આયોગે તેના તા. ૦૯.૦૬.૨૦૨૦ ના હુકમ અન્વયે સ્વયં અરજી નં ૧૮૭૨/૨૦૨૦ શરૂ કરવા તેમજ સ્ટેક હોલ્ડરો પાસેથી અભિપ્રાય અને સુચનો મંગાવવાનું નક્કી કર્યું હતું.

આયોગે ઉપર્યુક્ત હુકમ અન્વયે, બાકી ના રાજ્યના વિતરણ પરવાનેદારો દ્વારા RPO ના અમલીકરણની ખરાઇ કરવા સ્વયં કાર્યવાહી શરૂ કરવા સંબંધિત વિતરણ પરવાનેદારો જેમકે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, ટોરેન્ટ પાવર લિમિટેડ (દહેજ), દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ તથા ગીફ્ટ પાવર કંપની લિમિટેડ સામે જોગવાઈઓ અનુસાર તેવાં જરૂરી પગલાં કરવાનો નિર્ણય કરેલ છે. વધુ મા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (નોડલ એજન્સી) ને સામેલ કરવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ, આયોગ દ્વારા સ્વયં અરજી નં. ૧૮૭૨/૨૦૨૦ તૈયાર કરવામાં આવેલ છે. જે આયોગની વેબસાઇટ www.gercin.org ઉપર મૂકવામાં આવેલ છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(કારોબારીનું સંચાલન) વિનિયમો ૨૦૦૪ અનુસાર, આથી અહીં જાહેર કરવામાં આવે છે કે, ઉપરની સ્વયં કરાયેલી અરજીના સંબંધમાં જેમને તેના વાંધા/સુચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માંગતા હોય તે એફિડેવિટથી યોગ્ય રીતે સમર્થિત દસ્તાવેજો સાથે તા. ૩૧.૦૭.૨૦૨૦ પહેલા સચિવશ્રી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છબ્બે માળ, ગિફ્ટ વન, માર્ગ ૫-સી, ઝોન ૫, ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાત ને રજૂ કરી શકશે અને તેઓની રૂબરૂ માં સાંભળે તેમ તેઓ ઇચ્છે કે કેમ તે પણ તેમાં દર્શાવે. સ્વયં કરાયેલી અરજી નં. ૧૮૭૨/૨૦૨૦ માટેની સુનાવણીની તારીખ ૦૭.૦૮.૨૦૨૦ ના રોજ ૧૧:૩૦ વાગ્યે નક્કી કરી છે.

આ અંગેની વધારાની માહિતી આયોગની વેબસાઇટ www.gercin.org પર ઉપલબ્ધ છે.

ગાંધીનગર
તા. ૨૨/૦૬/૨૦૨૦

સહી/-
સચિવ
જી.ઈ.આર.સી.
ગાંધીનગર, ગુજરાત